



BBG-1901250102020500 Seat No. \_\_\_\_\_

M. A. (Sem. II) (CBCS) (W.E.F. 2019) Examination

July - 2021

Economics

Macro Economics-2

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

સૂચના : (1) બધા જ પ્રશ્નોના ગુણ સરખાં છે.  
(2) કોઈપણ પાંચ પ્રશ્નોના ઉત્તર આપો.

- 1 કુગાવાનો ખ્યાલ સમજાવો અને કુગાવાના પ્રકારોની વિગતે ચર્ચા કરો. 14
- 2 ફીલીપ્સ વક્ર આકૃતિ દોરી સમજાવો, તેનું મહત્ત્વ જણાવો. 14
- 3 વ્યાપારચક્રનો ખ્યાલ સમજાવો, તેના તબક્કાઓની ચર્ચા કરો. 14
- 4 વ્યાપાર ચક્ર અંગે પ્રો.જ્હોન રોબિનસનનો સિદ્ધાંત સમજાવો. તેની સમીક્ષા કરો. 14
- 5 વ્યાજનો ધિરાણ ભંડોળનો સિદ્ધાંત સમજાવો. તેનું મૂલ્યાંકન કરો. 14
- 6 IS-LM મોડેલ આકૃતિની મદદથી સમજાવો. 14
- 7 કેઈન્સનો વપરાશનો મનોવૈજ્ઞાનિક નિયમ સમજાવો તેની સમીક્ષા કરો. 14
- 8 વપરાશ વૃત્તિને અસર કરતાં પરિબળો વિગતે ચર્ચો. 14
- 9 ટૂંકનોંધ લખો : 14  
(૧) કુગાવાજન્ય ગાળો  
(૨) તર્ક સંગત અપેક્ષાઓનો સિદ્ધાંત
- 10 ટૂંકનોંધ લખો : 14  
(૧) પ્રશિષ્ટ અને કેઈન્સના વ્યાજના સિદ્ધાંતની તુલના  
(૨) નિરપેક્ષ આવક અને સાપેક્ષ આવકનો અભિગમ

## ENGLISH VERSION

**Instructions :** (1) All questions carry equal marks.  
(2) Attend any five questions.

- |           |  |           |
|-----------|--|-----------|
| <b>1</b>  | Explain the concept of inflation and discuss in detail the kinds of inflation.   | <b>14</b> |
| <b>2</b>  | Explain Philips Curve with diagram. State its importance.  | <b>14</b> |
| <b>3</b>  | Explain the concept of trade cycle. Discuss phases of business cycle.  | <b>14</b> |
| <b>4</b>  | Explain business cycle theory of Prof. John Robinsion Evaluate it.   | <b>14</b> |
| <b>5</b>  | Explain Loanable theory of Interest. Evaluate it.  | <b>14</b> |
| <b>6</b>  | Explain IS-LM model with diagram.  | <b>14</b> |
| <b>7</b>  | Explain Keynes psychological law of consumption. Evaluate it.  | <b>14</b> |
| <b>8</b>  | Discuss in detail factors affecting propensity to consume.   | <b>14</b> |
| <b>9</b>  | Write Short notes :<br>(1) Inflationary Gap<br>(2) Theory of Rational Expectations   | <b>14</b> |
| <b>10</b> | Short notes :<br>(1) Comparison of Classical and Keynesian theory of interest.<br>(2) Absolute and Relative income approach. | <b>14</b> |